

PANTH Infinity INTENDED TO INSPIRE

2nd September, 2020

To.

BSE Limited

The Department of Corporate Services P. J. Towers, Dalal street, Mumbai-400 001.

Maharashtra.

BSE Code: 539143

To.

The Calcutta Stock Exchange Limited

The Compliance Department 7, Lyons Range, Dalhousie, Murgighata, B B D Bagh, Kolkata-700001, West Bengal

CSE Code: 30010

Sub.: Newspaper publication of Financial Results

Dear Sir/Madam.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2020 published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper dated 2nd September, 2020.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully,

For PANTH INFINITY LIMITED

RICKY KAPADIA

Company Secretary & Compliance Officer

ACS No.: 60440

PANTH INFINITY LIMITED | CIN: L45201GJ1993PLC114416

Registered Office: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujarat.

Branch: 7/56, 3rd Floor Desh Bandhu Gupta Road, Karol Bagh New Delhi - 110005 Website: www.dcbbank.com Tel: (011) 45016060 / 55

DCB BANK

Auction Sale notice for Sale of Immovable Property Under Rule 9(1) of SARFAESI ACT

SALE Notice for sale of Immovable Assets Charged to the DCB BANK UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 read with proviso to 8(6) of the security Interest (Enforcement) Rule

Notice is hereby given to the public in general and to the borrower, co-borrowers and the guarantors in particular, by the Authorized Officer, that the under mentioned property is onortgaged to DCB Bank Limited. The Authorized Officer of the Bank has taken the physical possession under the provision of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 on 20-07-2020. The property will be sold by tender cum public auction as mentioned below for recovery of under mentioned dues and urther interest, charges and cost etc. as per the below details:-

The property will be sold "as is where is", "as is what is" and "Whatever there is" condition

Name of the Borrower & Guarantors: Deepak Kumar Khanna / Dream Comforts / Anjana Khanna / Tarun Khanna / Apoorv Khanna

Details of Mortgage Property: Flat No. 1005, 10th & 11th Floor, Tower - Ferrara, Mahagu Mansion Phase 1, Plot No. 1/5, Vaibhav Khand Indirapuram Ghaziabad, Uttar Pradesh

Reserve Price	Earnest Money Deposit (EMD)	Date & Time of Auction	Type of Possession
Rs. 1,20,00,000/- (Rupees One Crore Twenty Lakh Only)	Rs. 12,00,000/- (Rupees Twelve LakhOnly)	06-10-2020 12:30 PM To 4:00 PM	PHYSICAL

Offers are invited in sealed envelope by the undersigned from the intending buyers / bidders for the purchase of the above said property. The interested buyer may send their offer for the above property in the sealed envelope along with Demand Draft in favor of "DCB Bank Limited", New Delhi toward the "Earnest Money Deposit" at DCB Bank Limited, 7/56 3rd Floor, Desh Bandhu Gupta Road, Karol Bagh, New Delhi - 110005 on or before 04:30 PM of 05-10-2020. The sealed offer will be opened on 06-10-2020 at 12:30 PM on the date of auction at above mentioned branch. The EMD is refundable without any interest if the bid is not successful. The intending buyer may inspect the property / asset latest by the date mentioned above for which they may contact MR. Pramod Chand or Mr. Shyamsunder Chandhok (011) 45016298 / 99 For detailed, terms and conditions of the auction sale please refer to the link https://www.dcbbank.com/cms/showpage/page/customer-corner

Date: 01-09-2020 Place: Delhi

Authorised Office

TRINITY LEAGUE INDIA LIMITED Regd. Off.: A-23, Mandakini Enclave, Alaknanda, GK II, New Delhi-110019 Contact- 011-40562329, website: www.trinityasia.in E-mail: trinityleague@trinitygroup.ind.in

Notice of Annual General Meeting It is hereby informed that the 32th Annual General Meeting (AGM) of Trinity League India Limited will be held on Monday the 28th day of September 2020 at 12.00 PM. Through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM only through e-voting facility.

The AGM will be held only through VC / OAVM in compliance with the provisions of the Companies Act, 2013 and circulars dated May 5, 2020, April 8, 2020 and April 13, 2020) issued by the Ministry of Corporate Affairs and SEBI Circular dated May 12, 2020. The instructions for joining the AGM electronically are provided in the Notice of the AGM. Notice of the AGM along with the Annual Report 2019-20 is being sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company or CDSL/NSDL ('Depositories") and will also be available on the Company's

website www.trinityasia.in and website of the Bombay Stock Exchange i.e. a www.bseindia.com. Members who have not registered their e-mail addresses and in consequence the Annual Report including Notice of AGM and e-voting instructions could not be serviced, may get their email address and mobile number registered with the Company's Registrar and Share Transfer Agent, Beetal Financial & Computer Services (P) Limited, by sending mail on

nvestor@beetalfinancial.com for the same along with scanned copy of the signed reques letter providing the email address, mobile number, self-attested PAN copy and Clien Master copy in case of electronic folio and copy of share certificate in case of physical folio for obtaining the Annual Report, Notice of AGM and the e-voting instructions The remote e-voting period will commence from 25th September, 2020 at 10:00 am and will end at 5.00 pm on 27th September, 2020. During this period the eligible shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, may cast their vote electronically. The e-voting module will be disabled by CDSL for voting thereafter i.e. voting shall not be allowed beyond 5:00 p.m. on September 27, 2020. Facility for e-voting shall also be made available during the AGM to those Members who attend the AGM and

voting prior to the AGM may also attend/ participate in the AGM through VC / OAVM but shall not be entitled to cast their vote again. The cut-off date for determining the eligibility of members for voting through remote e-voting and e-voting at the AGM is Monday, September 21, 2020. Any person, who becomes a member of the Company after the dispatch of Notice and holding shares as on cut-off date may obtain the login ID and password by sending a request to r@beetalfinancial.com to cast his/her vote. The detailed procedure for obtaining the

who have not already cast their vote. The Members who have cast their vote by remote e-

login ID and password and exercising e-voting is provided in the Notice of AGM.

Members holding shares in electronic form are requested to intimate any change in their bank mandates to their Depository Participants with whom they are maintaining their dema accounts. The Company or its RTA cannot act on any request received directly from the Members holding shares in electronic form for any change of bank particulars or bank mandates. Such changes are to be advised only to the Depository Participant of the Members. The Members holding shares in physical form are requested to advise any change in their bank mandate immediately to Beetal House, 3rd Floor 99 Madangir, Behind Local Shopping Centre, Near Dada Harsukhdas Mandir, New Delhi- 110062.

By Order of the Board of Director For Trinity League India Limited

Place: New Delhi Date : September 02, 2020 Piyush Kumar Srivastava **Company Secretary**

CESCO Commercial Engineers & Body Builders Co Ltd.
Registered Office: 48, Vandana Vibar Name Ltd. Registered Office: 48, Vandana Vihar, Narm Rond, Gorakhpur, Jabalpur (M.P.) India CIN: L24231MP1979PLC049375 Telo No.: 6781-2681336, Email: cs@cebbco.com, Websile: www.cebb

NOTICE OF 40TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

of Commercial Engineers & Body Bulders Co. Limited. (The Company") will be held on Printeday. September: 24, 2021 at 12:30 P.M. Intrough electronic mode (video conference. ("VC") or Other Audio Viquel Meetrs ("QAVM") without the physical presence of the Members at a common senue, in compliance with General Circular No. 4/2020 Dated April 65, 2020, No. 17/2020, Dated April 13, 2020 and No. 202020 date lay 05, 2020 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars" encircable provisions of the Companies Act, 2013 and circular essued by the Securitie ind Exchange Board of India Disted May 12, 2020 ("SEB) Circular") to biassed the uniness as secoul in the Notice convening the 45th AGM Disted August 24, 2020.

lakte is also hereby given pursuant to section 91 of the Companies Act, 2013; Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Requision 42 of the (Listing Obligation & Districture Requirements) Regulations, 2016, that the Register of Members and the Share Transfer Blocks of the Company shall romain closed from Monday, 21st September, 2020 to Thursday, 24th Septembe 2020 (both dates inclusive) for the purpose of Armual General Meeting

compliance with the said MCA circulars and SEB1 Circular, the Company has sent volce of the AGM and Annual Report 2019-20 on 1st September 2020, throug Restracts made to all the members whose omail IDs are registered with the Compani Depository Participant(s). These documents are also synthable on the website of th Company of www.oebbco.com without of the Stack Exchange is BSE Limited at www.bserodia.com and National Stock Exchange of India Limited at www.hseindia.com and on the website of Share Transfer Agent of the Company viz Klim Tractinologies Private Limited (hereinatter referred to as KFin') at

https://evoting.karvy.com. Pursuant to provisions of section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules. 2014 as attended and Regulation (4 of the SEB) (Listing Obligations and Disclosure Registernes) is Regulations, 2015, members holding shares in physical or demandistrate form, as or the cut-off date i.e., 17th September, 2021, may cast their vote electronically an the business an set and in the Notice of 40th AGM of the Company through evicting latform of Kiln through their portal https://evoting.karvy.com rocedure/instructions for e-voltnigare contained in the Notice of 40th/4GM

n this regard, the Members are having further notified that a. Remote e voting through electronic means shall commence from 71st Septembe 8920 (9.00 a.m.) and entire 23st September 2020 (6.00 p.m.)

Cut-off date for the purpose of e-voting shall be 17th September, 2020.

. Persons who have adquired shares and become members of the Company after the dispartin of Notice and sing are elegible charenoiders as on the cut-off date i.e. 17th September, 2020, may contact Mr. Seyem Kumur on (040) 6716-1558 or shyam kuman@kfintech.com/tochtein/file/ognidand-password.

Remote e-valing through electronic movins shall not be allowed beyond 5.00 p.m. o 3rd September, 2020.

e. Manibers present at the reseting tripugh VC I GWM facility and who had not can her rotes on the resolutions that up it employees and are otherwise not barrefrom doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The instructions for interesting the AGM through VCI GWM are provided in the Notice of the AGM.

 Members who have cast their votes by remote e-voting pror to the AGM may all alterdiparticipation the AGM through YCTOAVM family, but shall not be allowed to be Noir unbes againt

g. A person whose name is recorded in the register of members or in the register is beneficial owners maintained by the depositiones as on the cut-off diste only shall be onlifted to avail of the lability of remote a-valing as well as e-valing during the AGM.

 In case of any gravance in connection with the facility for remote a-voting, the sho pidets may contact Mr. Shyam Kumar or refer to the Frequently Asked Question. FAOs) section(s-voling user manual for shamhelders available at the Cloysland ection on https://evating.karvy.com. Members who have not registered their email addresses and mobile numbers.

inquested to temporarily get themselves registered with Kilo, by slicking the link https://eis.kfintech.com/email_registration to receive copies of the Annual Report or FY 2019-2020 slong with the Notice of the 40th AGM containing the detaile procedure and instruments for remote e-volving and instructions for participation in th AGM through VC/OAVM facility.

Fleese keep your most upraced extent is registered with the company/you Departory Participant to receive timely communication

For Commercial Engineers & Body Builders Co Ltd

Amit Kumar Jain Company Secretary AC5 -39779

UP POWER CORPORATION LIMITED NOTICE INVITING **TENDER (THROUGH E-BID-**DING ONLY) TENDER SPECIFI-CATION NO. 01/PLG/UMPP HYDRO/400 MW/2020 UP Power Corporation Limited on behalf of Distribution Licensees of U.P. invites proposals for procurement of 400 MW of power from Hydro Power Generating Station(s) for a period of 25 (Twenty Five) years Bidders may download the Bidding Document from MSTC ecommerce (DEEP website Portal https://mstcecommerce.com from 04.09.2020 onwards. The last date of submission of Bid is 05.10.2020 at or before 14:00 hrs (IST) on the MSTC ecommerce portal (DEEP Portal). Response to invitation will be opened on the same day at 15:00 hrs (IST) on the above portal. Bidders should regularly visit website to keep them selves updated regarding clarifications / amendments time extensions, etc., if any. Note: UP Power Corporation Limited reserves the right to cancel or modify the process without assigning any reason and without any liability. This is not an offer.Sd/- Chief Engineer (Planning) UP Power Corporation Limited (A Govt. of UF Undertaking) 3rd Floor, Shakti Bhawan Extn., 14 Ashok Marg Lucknow - 226001 Email cgm2plg@yahoo.co.in/cgm2plg@ gmail.com Phone no. 0522-2287343 सं. 222 जस/पाकालि/2020 दिनांक 01.09.2020

HERO FINCORP LIMITED Regd. Office: 34, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057

POSSESSION NOTICE [(Appendix IV) Rule 8(1)]

Whereas the Authorized officer of Hero FinCorp Limited (HFCL), a Non-Banking Financial Company, under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 0F 2002) (hereinafter referred to as "Act") and in exercise of the powers conferred under Section 13(2) of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued a Demand Notice dated 14.11.2019, which was published in newspape on 27.11.2019 calling upon:

M/s The Sant Namdev Educational Society (Borrower), having its office at Presidium, Sector - 6 Dwarka, New Delhi - 110075 and also at A-172, Block - A, Meera Bagh, Paschim Vihar, New Delhi - 110087.

Mrs. Raj Rani Gupta (Guarantor), residing at A-172, Block - A, Meera Bagh Paschim Vihar, New Delhi - 110087. Mr. Akash Gupta (Guarantor) residing at A-119, Block - A, Meera Bagh

Paschim Vihar, New Delhi - 110087.

Mrs. Sudha Gupta (Guarantor) residing at A-172, Block - A, Meera Bagh Paschim Vihar, New Delhi - 110087. Mr. Gurmeet Singh Matharoo (Guarantor) residing at A-172, Block - A, Meera

Bagh, Paschim Vihar, New Delhi - 110087. o repay the amount mentioned in the notice Rs.12,62,63,102.02/- (Rupees Twelve Crores Sixty Two Lakhs Sixty Three Thousand One Hundred and Two and Paise

Two Only) as on 22.10.2019 along with the applicable interest and other charges within Sixty (60) days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, Notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-

section (4) of section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement Rules, 2002 on 31th day of August, 2020. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of HFCL for an amount of Rs.12,62,63,102.02/- (Rupees Twelve Crores Sixty Two Lakhs Sixty Three Thousand One Hundred and Two and Paise Two Only) as on

The attention of the Borrower is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asse

22.10.2019 along with the applicable interest and other charges.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY/SECURED ASSETS IS AS UNDER: MOTHERS PRIDE (NOW KNOWN AS 'PRESIDIUM'), SECTOR 6, DWARKA, NEAR DISTRICT PARK, NEW DELHI-110075,

Date: 31.08.2020

Authorized Office Hero FinCorp Limited

CIN: U74899DL1991PLC046774 | Tel: 011-49487150 | Fax: 011-49487197 Email: legal@herofincorp.com | website: www.herofincorp.com

SKYWEB INFOTECH LIMITED

Regd. Office: K-20, 2nd Floor, Lajpat Nagar Part-2, New Delhi-110 024 Corporate Office: Plot No. 2A, First Floor, Sector 126, Noida, Uttar Pradesh-201301 Ph: 0120-6721800 Website: www.skywebindia.in Email: info@skywebindia.in

Annual General Meeting & Book Closure

Notice is hereby given that the 35th Annual General Meeting of the members of the Company will be held on Monday, the 28th day of September, 2020 at 02:00 P.M at K-20, 2nd Floor, Lalpat Nagar-II, New Delhi-110 024. Also, in compliance with Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members will remain closed from Tuesday, 22rd September, 2020 to Monday, 28th September, 2020 (both days inclusive). Pursuant to the General Circular No. 14/2020, 17/2020, 20/2020 and all other applicable ws and circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and Sec Exchange Board of India ("SEBI") only electronic copies of the Notice of AGM along with the Annual Report for the Financial Year 2019-20 will be sent to those shareholders i e-mail id are registered with the Company/ Depository Participants, to transact the esses as set out in the Notice of AGM.

Notice of the AGM will also be available on the Company's website at www.skywebindia.in and at the website of Stock Exchange i.e. www.msei.in and at CDSL's website a

Shareholders holding shares in dematerialised mode, are requested to register their emai address and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode are requested to furnish the email addresses and mobile numbers with the Company's Registrars and Share Transfe Agent M/s Beetal Financial and Computer Services Private Limited ('Beetal') at Beeta use, 3rd Floor, 99, Madangir, New Delhi – 110062, Telephone: 011-29961281-83; Fax 011 29961284; Email: beetal@beetalfinancial.com.

Voting through Electronic Mode

Notice is also hereby given that the businesses proposed to be transacted at the 35th Annual General Meeting may be transacted by electronic voting. The cut-off date for determining the eligibility to vote by electronic means or in the general meeting is 21th Septemb 2020. The remote E-voting period will commence from Friday, 25th September, 2020 at 9:00 A.M. and will end on Sunday, 27th September, 2020 at 5:00 P.M. Remote E-voting shall not be allowed beyond the aforesaid period. The persons who have acquired share and have become member of the Company after the dispatch of notice may obtain the login ID and password from Central Depository Services Limited (CDSL) on the help desi No. 18002005533 / 022-23058542 or send an e-mail at helpdesk.evoting@cdslindia.com or send physical communication to Mr. Rakesh Dalvi, Manager at A Wing, 25th Floor, Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (E) Mumbai- 400013. Above mentioned person(s) can also be contacted to address the grievances connected with facility for e-voting by electronic means.

A person whose name is recorded in the Register of Members or in the regist beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote E-voting as well as voting in the general meeting. A member may participate in the general meeting even after exercising his/her right to vote through remote E-voting but shall not be entitled to vote again in the meeting. The members present at the meeting, having not exercised their vote by E-voting or ballot shal e entitled to vote by means of Poll.

By Order of the Board Skyweb Infotech Limited

Amit Mahajar Place: New Delhi Date: September 1, 2020 Company Secretary & Compliance Office

PANTH INFINITY LIMITED

Reg. Off.: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Hari (CIN: L45201GJ1993PLC114416)

Tel: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com

	Extract of Standalone Unaudited Financial Results for the						
	Quarter Ended	d 30th Jun	e, 2020		(₹ In Lacs)		
Sr. No.	Particulars	Quarter ended 30.06.2020 31.03.2020 30.06.2019			Year ended 31.03.2020		
MŲ.		(Un-audited)	(Audited)	(Un-audited)	(Audited)		
1	Total income from operations (net)	272.72	379.26	443.78	1768.25		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	20.86	14.97	26.08	-2.93		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	20.86	14.86	26.08	144.16		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	15.57	27.35	19.57	143.17		
5	Total comprehensive Income for the period [comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	20.39	9.60	-31.19	-169.07		
6	Equity Share Capital (face value of Rs. 10/- each)	1232.50	1232.50	1232.50	1232.50		
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of the previous year)	0.00	0.00	0.00	999.55		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)						
	Basic EPS	0.12	0.22	0.16	1.16		
	Diluted EPS	0.12	0.22	0.16	1.16		

Notes:

1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter ended on 30.06.2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly audited Financial Results are available on the Stock Exchanges websites: www.bseindia.com and www.cse-india.com and on the Company's Website: www.panthinfinity.com

www.pantninninity.com

2. The above financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 31st August, 2020.

3. The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder. For PANTH INFINITY LIMITED

Place : Surat. Date: 31-08-2020 Chairman & Managing Director DIN: 03362317

EAST BUILDTECH LIMITED CIN: L74999DL1984PLC018610

Read, Office: D-3/2, Okhla Industrial Area, Phase - II, New Delhi - 110 020 Website: www.ebl.co.in, E-mail: secretarial@ebl.co.in, contact@ebl.co.in Phone: 011-47105100 NOTICE

Notice is hereby given that the 36th Annual General Meeting of the Company wil be held on Tuesday, 29th September, 2020 at 12:00 Noon at 1, DSIDC Complex Okhla Industrial Area, Phase I, New Delhi-110020 for the purpose of transacting the business mentioned in Notice separately dispatched to the Members. The dispatch of notice along with e-voting instructions and Annual Report has completed on 31st August, 2020 and the e-voting instructions can be downloaded from www.evotingindia.com and from company's website www.ebl.co.in

Pursuant to Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 along with the applicable Rules made there under, it is hereby intimated that the Register of Members and Share Transfer Books of the Company will remain closed fromWednesday, 23rd September 2020 to Tuesday, 29th September, 2020 (Both days inclusive).

Pursuant to provisions of Section 108 of Companies Act, 2013 read with rules 20 o the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide electronic voting facility for transacting all the business items as mentioned in the AGM notice. The e-voting facility will be available on the platform of Central Depository Services (India) Limited (CDSL). The Notice of AGM has sent physically and electronically on 31st August, 2020. The e-voting will commence on Saturday, 26th September, 2020 at 09:00 a.m. and end on Monday, 28th September, 2020 at 5.00 p.m. No e-voting shall be allowed beyond the said date and time i.e. after 5.00 p.m. on 28th September, 2020.

The notice of the Annual General Meeting along with e-voting instruction has also been displayed on the website www.ebl.co.in. Members may contact for any query or grievances if any, in voting through electronic mode on email a lpdesk.evoting@cdslindia.com

Members can participate in the Annual General Meeting even after exercising their right to vote through e voting but shall not be allowed to vote again in the Meeting. Members who are holding shares as on cut off i.e. 22nd September, 2020 may cast their vote at Annual General Meeting of the Company through Ballot paper The information of the concerned person who will be responsible to address the rievances connected with facility for voting by electronic means is as follows:

Name: Mr. Rakesh Dalvi

Designation: Manager Address: Central Depository Services (India) Limited Marathon Futurex, A-Wing 25th Floor, Mafatlal Mills, Compound N. M. Joshi Marg, Lower Parel, (East) Mumbai-400013

E-mail ID: helpdesk.evoting@cdslindia.com Phone Number: 022-23058738 / 022-23058542/43

The shareholders may contact Registrar & Share Transfer Agent or their respective Depositories for registration/updating of their email IDs and other matters

For East Buildtech Limite

Place: New Delhi Date: 1st September, 2020

(Company Secretary) **OSCAR GLOBAL LIMITED**

Richa Malhotra

R.O.: 1/22, 2nd Floor, Asaf Ali Road Delhi- 110002 CIN: L51909DL1990PLC041701 Tel. No: 9810337978 Email: oscar@oscar-global.com Website: www.oscar-global.net

Notice of AGM: NOTICE is hereby given that the 29th Annual General Meeting ("AGM" of the Members of Oscar Global Limited will be held on Tuesday, 22nd September, 2020 at 11:00 A.M. through Video Conferencing ("VC") Other Audio Visual Means ("OAVM"), to transact businesses set out in the Notice of the AGM dated 18th August, 2020. The Notice of the AGM and the Annual Report for the year ended March 31, 2020 has been separately sent in electronic mode to all those Members whose emai addresses are registered with the Company / Depository Participants. The Annual Reports and a copy of the Notice of AGM is also available on the website of the Company (www.oscar-global.net) and on the website at www.evoting.nsdl.com. The electronic dispatch of the Notice of AGM and Annual Report has been completed on August 31, 2020.

E-Voting:

The Company has entered into an arrangement with National Securities Depository Limited ('NSDL") for facilitating remote e-voting services. The details pursuant to the provision of the Companies Act, 2013 and the Rules are given hereunder:

- (1) Date of completion of sending of Notices : August 31, 2020
- Date and time of commencement of Voting through electronic means: Saturday, 19th September, 2020 at 10:00 A.M
- Date and time of end of Voting through electronic means: Monday 21st September, 2020 at 5.00 P.M Voting through electronic means shall not be allowed beyond 5.00
- P.M on Monday, 21st September, 2020. Cut-off date for determining the eligibility to vote by electronic means is 15th September, 2020.
- Members may participate in the Annual General Meeting even after exercising his/her right to vote through remote e-voting but shall
- not be allowed to vote again in the meeting. Persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depository as on the cut-off date only shall be entitled to avail the facility to remote

e-voting as well as voting in the general meeting

- Members may note that: a) the remote e-voting module shall be disabled by NSDL after aforesaid date and time for voting : b' Members participating in the 29th AGM and who had not caste their vote by remote e-voting, shall be entitled to cast their vote through e-voting system during 29th AGM.
- Any person who acquire shares of the company and become member of the company after dispatch of the notice and holding shares as on the cut-off date i.e. 15th September, 2020 may obtain the login id and password by sending a request at evoting@nsdl.co.in or Issuer/RTA
- 10) The Notice of 29th AGM is available on the Company's website www.oscar-global.net and on www. evoting.nsdl.com
- (11) For electronic voting instruction, shareholders may go through the instruction in the Notice of 29th AGM and in case of any queries grievances connected with electronic voting, Shareholders may refer the Frequently Asked Questions (FAQs) and E-Voting Use Manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990.

Compliance of applicable provisions of the Companies Act, 2013, the Company encourages the Members to provide / update their e-mail address to enable the servicing of notice(s)/ documents(s)/ Annual Report(s) electronically. The request for updation of records for members nolding shares in physical mode should be sent to the Company or RTA and to the Depository Participant in case of members holding shares in dematerialized mode.

By order of the Board of Directors Oscar Global Limited

Karan Kanika Verma (Chairman & Managing Director) DIN: 00034343

केनरा बैंक \Delta Canara Bank 🖟 रिगोक्केट Syndicate

Premises & Estate Section, Circle Office, Vipin Khand, Gomti Nagar, Lucknow-226010 PREMISES REQUIRED

ed under TWO BID SYSTEM from

ommercial space preferably in the Ground floor and ready for occupation ith required Power load, for Retail Asset Hub at the following location: District Carpet Area Area Power Load Place within the city Jhansi 1400 Sft 20-25 KW Jhansi within the city

The details are published in the Bank's Website: http://www.canarabant.com. The necessary application forms may be obtained from our offic (0522-2307611) OR downloaded from the Bank's website. Last date for submission is 22-09-2020 upto 3:00 PM. Bank reserve its rights to reject any or all the offers without assigning any reasons whatsoever. Furthe communications, corrigendum, amendments, if any, will be hosted it Bank's website only.

Our previous invitation of bids published on 31.05.2020 for opening of Retail Asset Hub at Jhansi stands cancelled.

INDIAN TONERS & DEVELOPERS LIMITED

DEPUTY GENERAL MANAGER



Regd. Office: 10.5 Km Milestone, Rampur Bareilly Road. Rampur - 244 901 (U.P.) (CIN NO. L74993UP1990PLC015721)

Phone No. 0595-2356271 Fax No. 0595-2356273 Notice of 30th Annual General Meeting (AGM) **Book Closure and Remote E-Voting information**

Notice is hereby given that the 30th Annual General Meeting of the members of INDIAN TONERS & DEVELOPERS LIMITED will be held on Monday, 28 September, 2020 at 2.30 p.m. at the Regd. Office of the Company at 10.5 Km Milestone, Rampur Bareilly Road, Rampur - 244 901 (U.P.) to transact such Ordinary/Special businesses as set out in the Notice convening the said Meeting.

Electronic copy of Notice of 30th AGM and instructions for remote e-voting and oting, alongwith Attendance Slip and Proxy Form and Annual Report 2019-2020 have been sent to all the members whose email IDs are registered with the Company Depository Participant(s) for communication purposes unless any member has equested for a hard copy of the same. For members who have not registered their e mail address, physical copies of the above documents have been sent in the

Notice is further given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books will remain Closed from 24th July, 2020 to 27th July, 2020 (Both days inclusive) for the purpose of the 30th Annual General Meeting of the Company As per Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, issued by Ministry of Corporate Affairs, Government of India and Regulation 44 of the Listing Regulations with Stock Exchanges, the Company is pleased to provide its Members the facility to

- and Rule 20 of the said Rules, are given here under:
- Date of completion of sending of notices: 01.09.2020. Date and time of commencement of voting through electronic means (remote evoting): September 25, 2020 at 9.00 a.m. (IST).

cast their vote by electronic means through remote e-voting on all resolutions set

forth in the Notice. The details pursuant to the provisions the Companies Act, 2013

- Date and time of end of voting through electronic means (remote e-voting) September 27, 2020 at 5.00 p.m. (IST). Voting through electronic means (remote e-voting) shall not be allowed beyond
- 5.00 p.m. (IST) on September 27, 2020. Notice of the 30th AGM, along with procedure for remote e-voting and voting is
- also available on the website of the NSDL at www.evoting.nsdl.com Details of persons to be contacted for issues relating to e-voting: Mr. S. C Singhal, Company Secretary & Compliance Officer as investors@indiantoners.com / Telephone No. 45017000 and NSDL at evoting@nsdl.co.in /amitv@nsdl.co.in /pratikb@nsdl.co.in Ph. 022-24994738/ 24994600/ NSDL Help Desk at Tel No. (Toll Free) 1800-222-990.
- Shri Varanasi Hari (CP No. 8244), a Practicing Company Secretary has been appointed as the Scrutinizer for the remote e-voting and voting process.

Any person, who acquires shares and become members of the Company after dispatch of the notice and holding shares as on the cut-off date i.e. 21.9.2020, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in and then cast his/her vote accordingly. However, if the members are already registered with NSDL for remote e-voting then they can use their existing user ID and password for casting their vote

The facility for voting through ballot paper shall be made available at the AGM and the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again

The voting right of shareholders shall be in proportion to their share in the paid up equity share capital of the Company as on the cut - off date (record date) as on 21.9.2020.

By Order of the Board

Company Secretary

(S. C. Singhal)

for Indian Toners & Developers Limited

Place: New Delhi Date: 01.09.2020

BRIGHTSTAR TELECOMMUNICATIONS INDIA LIMITED Regd. Office: First Floor, Plot No. 16, Udyog Vihar, Phase IV, Gurgaon - 122015, Harvana, India

Corporate Identification Number: U32204HR1999PLC042204 Ph. No.+91 124 4823500 and Fax No. +91 124 4146130 We b site: www.bright starcorp.in, Email: legal.secretarial@bright starcorp.inNOTICE OF 21STANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 21st Annual General Meeting ("AGM") of the members of Brights ns India Limited ("the Company") will be held on Friday, 25" day of Septemb 2020 at 2:00 P.M. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), to ransact the businesses as set out in the Notice of AGM in compliance with the applicable provisions of the Companies Act. 2013 ("Act") and Rules framed thereunder read with Circula Nos.14/2020 (dated 8th April 2020), 17/2020 (dated 13th April 2020), and 20/2020 (dated 5th May 2020 sued by the Ministry of Corporate Affairs ("MCA Circular(s)") without the physical presence of

he Members at a common venue. Electronic copies of the Notice of the AGM and the Annual Report - 2019-2020 (for the financial year ended 31st March, 2020) of the Company have been sent to all the members whose email IDs are registered with the Registrar &Transfer Agent of the Company or Depository Participant(s) The dispatch of Notice of AGM has been completed on 31st August, 2020. Please note that the equirement of sending physical copy of the Notice of AGM and Annual Report to the Members nave been dispensed with vide MCA Circular(s). The Notice of AGM and the Annual Report 2019 -2020 are available on the website of the Company at www.brightstarcorp.in and on the website of NSDL at www.evoting.nsdl.com.

Members holding shares in physical mode and who have not updated their e-mail addresses with the Company are requested to update their e-mail addresses by sending email request a admin@mcsregistrars.com and/ or legal.secretarial@brightstarcorp.in along with scanned copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the PAN card and self-attested copy of any document (example: Aadhar, Driving License Election Identity Card, Passport). Members holding shares in dematerialised mode are requested to register / update their e-mail addresses with the relevant Depository Participants. The Notice of the AGM contains the instructions regarding the manner, in which shareholders can cast their vote through remote e-voting or by e-voting at the time of AGM. After updation of email ID embers may obtain the USER ID and Password by sending a request at evoting@nsdl.co.in.

n accordance with Section 108 of the Companies Act, 2013 read with Companies (Manageme & Administration) Rules, 2014 and MCA Circular(s), the Company has availed the electroni voting services from National Securities Depository Limited ("NSDL") and the Company has appointed Mr. Devesh Kumar Vasisht (CP No. 13700), Partner or failing him, Ms. Priyanka (CP No. 16187). Partner of M/s Sanjay Grover & Associates, Company Secretaries as the Scrutinize for AGM to scrutinize the voting process in a fair and transparent manner

the Ordinary and Special Business(es) as set out in the Notice of the AGM may be transacted through voting by electronic means;

the remote e-voting facility will be available during the following voting period: Monday, 21st September 2020 at 9:00 A.M (IST)

End of remote e-voting Thursday, 24th September 2020 at 5:00 P.M. (IST) members holding shares either in physical form or in dematerialized form, as on Friday, 18 September 2020 (the cut-off date), may cast their vote electronically on the Businesses as se out in the Notice of the AGM. A person who is not holding shares/ securities as on the cut of

date should treat this notice for information purpose only any person, who becomes member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as of the cut-off date i.e. Friday, 18th September 2020 may obtain the USER ID and Password by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing USER

ID and Password for casting the votes. a) the remote e-voting module shall be disabled by NSDL beyond 5:00 P.M. on 24 September 2020, the member shall not be allowed to change it subsequently;
b) in terms of MCA Circulars, members who attend the AGM will get facility of electronic

voting at AGM through NSDL platform only (detailed manner of attending AGM through VC has been mentioned in the notes of AGM Notice); c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may als

attend the AGM but shall not be entitled to cast their vote again; d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. Friday, 18th September $2020 \, \text{only shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGM}; \\$

case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholder and e-voting user manual for Shareholders available at the download section o ww.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request to a voting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager or Ms. Soni Singh, Asst. Manager National Securities Depository Limited, Trade World, 'A' Wing, 4" Floor, Kamala Mills Compound Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013, at the designated email id allavid@nsdl.co.in or SoniS@nsdl.co.in or at telephone nos.:- +91 22 24994545, +91 22

Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM and ir particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting of voting during the AGM.

> Brightstar Telecommunications India Limited Neeraj Manchanda Company Secretary

For and on behalf of the Board of Directors

Place: Jabalpur Date: 61,09,2020





Place: New Delhi













Date: 01.09.2020

Ahmedabad



સુરત શહેર-જિલ્લામાં ૨૩૨ નવા પ (CIN: L45201GJ1993PLC114416)

20663

+535

૨૧,૨૧૫

ઝોનમાં નોંધાયા હતા. જ્યારે રાંદેરમાં

૩૨ અને ઉધના વિસ્તારમાં ૧૯ લોકોને

કોરોનાનું સંક્રમણ થયું છે. શહેરમાં ૨

सुरतनी स्थिति

અગાઉના પોઝિટિવ

કુલ પોઝિટિવ

નવા પોઝિટિવ નોંધાયા

વધુ ૨૪૪ સહિત સારા થઇ ગયા

વધ્રુ દ સહિત કુલ મોત

સારવાર હેઠળ પોઝિટિવ

Tel: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com ૩૦ મી જુન ૨૦૨૦ ના રોજ સમાપ્ત થયેલા ત્રીમાસીક સમયગાળાના

7.4	અલાયદા બીનઅન્વેષીત નાણાંકીય પરીણામોનો સાર				
용	વિગત	पूरा थता श्रीभासीङ 30.05.२०२० ३२.०३.२०२० ३०.०५.२०१६		पुरा धता वर्षनुं ३१.०३.२०२०	
		(भीन सन्वेधीत)	(ઓટીડેટ)	(जीन अन्वेषीत)	(ઓટીકેટ)
9	સંચાલન માંથી કુલ આવક (ચોખ્ખી)	50.505	306.25	383.66	9656.54
5	સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પહેલા)	50.65	98.60	29.06	-5.63
3	કરવેરા પહેલાના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / ખોટ (અપવાદીત અને / અથવા અસાદારણ વસ્તુઓ પછી)	50.65	98.65	29.06	988.99
8	કરવેરા પછીના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	94.40	20.34	96.46	983.90
ч	समयगाणांनी दुस व्यापक आवक (समयगाणा हरभियाननो व्यापक नक़े)(ओट) (करवेरा पछी) अने अन्य व्यापक आवक (करवेरापछी)	50.36	6.50	-39.96	-996.00
9	ઇક્વીટી શેર કેપીટલ (પ્રતિ શેર રૂા.૧૦/– ની મૂળ કિંમત)	4535.40	9535.40	9535.40	4535.40
9	ભંડોળ (ગયા વર્ષની ઓડિટેડ પાકા સરવૈયા માં દર્શાવ્યા મુજબ પૂન:મુલ્યાંકિત ભંડોળ બાદ કરતા)	0.00	0.00	0.00	666.YY
c	શેર દીઠ આવક (પ્રત્યેક શેર રા.૧૦/– મુજબ) (સતત અને બંધ કામગીરી માટે) (અ) મૂળ ઈપીએસ (બ) ભેગી ઈપીએસ	9.92	0.22	0.95	9.95 9.95

નોંધ: ૧. સેબીના (લીર્સ્ટીંગ અને અન્ય જાહેરાતો માટે જરૂરી) નીયમ ૨૦૧૫ ની કલમ ૩૩ મુજબ સ્ટોક એક્ચેન્જમાં આપવામ આવેલ ત્રીમાસીક અને વાર્ષીક નાણાંકીય પરિણામોનો ટુંક સાર ઉપર આપવામાં આવ્યો છે. ત્રીમાસીક અને વાર્ષીક ઓડિટેડ નાશાંક્ચિ પરિશામ કંપનીની વેબસાઇટ www.panthinfinity.com અને સ્ટોક એક્ચેન્જની વેબસાઇટ એટલે કે www.bseindia.com અંને www.cse-india.com પર સંપુર્ણ અહેવાલ ઉપલબ્ધ છે.

. ઉપરોક્ત નાંણાકિય પરીણામોને ઓડિટ કમીટી દ્વારા ધ્યાને લેવામાં આવ્યા હતા અને તા.૩૧–૦૮–૨૦૨૦ ના રો૧ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં મંજુરી આપવામાં આવી હતી.

ા. ઉપરોક્ત નાણાકીય પરીણામો ઇન્ડીયન એકાઉર્ન્ટીંગ સ્ટાન્ડર્ડ (આઈએનડીએએસ) ના કંપની એક્ટ ૨૦૧૩ ને કલમ ૧૩૩ તેના અંતર્ગત સૂચીત કાયદાઓ અને સુચનાઓ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે પંચ ઈન્ફીનીટી લીમીટેક, વતી નય કોરડીયા

ઓફ ઈન્ડિયા

Corporation

कार्पोरेशन

સ્થળઃ સુરત ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર dl.: 39.06.2020 DIN: 03362317 युनियन भेंड રીઝનલ ઑફિસ સુરત : UNION BANK

દરમિયાન આજે મંગળવારે સુરતમાં નવા આવ્યું છે. ૧૭૪ અને જિલ્લામાં ૫૮ એમ મળીને

માર્ચ મહિનાથી શરૂ થયેલ ભેટતા મરણાંક ૮૨૧ ઉપર પહોંચી ગયો અલગ વિસ્તારમાં સર્વે કરીને કોરોનાનાં કોરોના મહામારી વચ્ચે સુરત શહેર છે. શહેરમાં અત્યાર સુધીમાં ૬૧૯ અને લક્ષણ ધરાવતા લોકોને શોધીને તેમનો ખાનગી હોસ્પિટલના ડોકટર, શહેરના અને જિલ્લામાં કેસની સંખ્યા ઘટવા સાથે જિલ્લામાં ૨૦૨ દર્દીઓના મોત નિપજયા ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. વધુ ગંભીર મજુરાગેટ પાસેના કાશી પ્લાઝાના મોતનો જે સિલસીલો યથાવત રહ્યો છે. હોવાનું આરોગ્ય તંત્ર દ્રારા જણાવવામાં ન હોય તેવા લોકોને હોમ આઇસોલેશન ડોકટર, વેડરોડ અને પાંડેસરાના કાપડના

આજે કોરોના સંક્રમણમાં વાપીની કરાઇ રહ્યા છે. ગંભીર હોય અને તાત્કાલિક કારખાનેદાર, કોહીનુર માર્કેટના સાડીના

૧૭૪ અને જિલ્લામાં ૫૮ એમ મળીને કુલ ૨૩૨ દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મંગળવારે શહેરમાં પોઝિટીવ અવેલા ૧૭૪ કેસ પૈકી સૌથી વધુ ૪૮ કેસ અઠવા રહેવાથી સુરત હજુ ભયમુક્ત નથી પરંતુ રિકવરીમાં વધારાથી રાહત

ધનવંતરી ૨થ સહિત આરોગ્યની અલગ- ભોગ બનેલા પૈકીના દર્દીઓનો રિકવરી સેમ્પલ લેવાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

મળતી વિગતો અનુસાર સરત શહેર અને ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર વોચમેનુ, સ્મીમેર હોસ્પિટલની નર્સ જિલ્લામાં ગત માર્ચ મહિનાથી લઇ અત્યાર ચાલી રહી છે. દરમિયાન મંગળવારે સુરત અને સુપરવાઇઝર, એચડીએફસી બેંકના સુધીમાં કુલ ૨૧૨૧૫ લોકો કોરોનાથી શહેર જિલ્લામાં નવા ૨૩૨ કેસ નોંધાવા ઓફ્સિર, સચીનની કાપડની મિલના સંક્રમિત થયા છે. જેની સામે કોરોનાની સામે કોરોનાની સારવાર લઇને સારા થઇ કર્મચારી મહિધરપુરા હિરાબજારના દલાલ સારવાર લઇને કુલ ૧૭,૫૫૫ લોકો ગયેલા શહેરના ૧૬૮ અને જિલ્લાના ૭૬ અને વેપારી, કોન્ટ્રાકટર અને રીંગરોડ કાપડ સ્વસ્થ થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા મળી વધુ ૨૪૪ દર્દીઓને રજા આપવામાં બજારના ચાર શ્રમજીવીઓ સહિત એમ આપવામાં આવી છે. સુરત મનપા દ્વારા આવી હતી, આમ, કોરોના સંક્રમણનો શહેરના કુલ ૧૭૪ વ્યક્તિઓને કોરોના

મનપાના આરોગ્ય વિભાગ પાસેથી સારવારની જરૂર હોય તેવા લોકોની સ્મિમેર વેપારી, ઘોડદોડ રોડના ભાર્વગ એપાર્ટમેન્ટના

ફોન : ૦૨૬૧–૨૪૬૧૫૩૫, ૨૪૬૨૯૨૩ (સ્થાવર મિલકતો માટે)

સિક્ચુરિટાઇપ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાબ્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ સાથે નિયમ ૮(૬) સાથે

નાનપુરા, સુરત-૩૯૫ ૦૦૧.

વંચાતી ધી સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોનું ઈ-હરાજીથી વેચાણ નોટીસ

છઠ્ઠો માળ, સૈફી બિલ્કીંગ, કચ ગાર્ડન રોડ,

નોટીસ આમ સામાન્ય રીતે જાહેર જનતાને આપવામાં આવે છે અને ખાસ કરીને ઉધારકર્તા(ઓ) / જામીનદારો (ઓ))ને આપેલ છે, નીચે જણાવેલ સ્થાવર મિલકતો, સુરક્ષિત કેડીટ ધારક બંધારણીય / ચાર્જ કરાઈ છે. તેના પર પ્રત્થા કબજો લેવામાં આવે છે. ચુનીચન બેંક ઓફ ઈન્ડિયાના અધિકૃત અધિકારીએ બેંકના બાકી રેકમની વસૂલાત માટે તા. ૦૭.૧૦.૨૦૨૦ના રોજ "જેમ છે ત્યાં છે" "જેમ છે તે છે" અને "ત્યાં જે છે ત્યાં" ધોરણે કિંમત અને ઇએમડી અને અન્ય વિગતો નીચે જણાવેલ કોષ્ટકમાં આપેલ છે. વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સિક્યોર્ડ કેડીટરએ ચુનીચન બેંક ઓફ ઈન્ડિયા થી માહિતી મેળવી શક્યો.

	સ્થાવર મિલકતોનું વર્ણન						
અ. જાં.	કરજદાર / જામીનદારનું નામ અને શાખાનું નામ	ડીમાન્ડ નોટીસની તારીખ / બાકી લ્હેણાં ની સ્ક્રમ	મિલકતની વિગત સાથે માલિક / ગિરવેદારનું નામ	અનામત કિંમત અને ઈએમડી	ઈએમડી માટે એ/સી નં.અને શાખાનું આઈએફ્સી કોડ	અધિકૃત અધિકારીનું નામ અને શાખાનું સંપર્ક નં.	
٩.	મે. સોલમ ફેબ્રીક્સના પ્રોપ. શ્રી પિશુપકુમાર એચ. બલર, ર) શ્રી સવજીભાઈ એમ. સરદારા, 3) શ્રી હિતેશભાઈ એમ. દામેલીથા ટેક્સટાઇલ માર્કેટ શાખા, સુરત.	૦૧.૦૫.૨૦૧૮ ફા. ૧,૫૫,૭૯,૧૫૪.૨૧ ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	શ્રી સવજીભાઈ એમ. સરધારાની માલિકીની પ્રીમાઈસીસ વાળી જે રો– હાઉસ નં. ૧૮૯, પુનીતધામ, લજામણી હોટલની પાછળ, મોટા વરાછા, સુરત ખાતે આવેલ તમામ હક્ક અને હિસ્સા સાથે. (પ્રત્યક્ષ કબજો)	য়া. 35,30,000/- য়া. 3,53,000/-	A/C. No.: 311101980050000 IFSC Code: UBIN0531111	શ્રી રાકેશ સિન્હા અધિકૃત અધિકારી, ટેક્સટાઇલ માર્જેટ શાળા, સુરત. ફોન : ૦૨૬૧-૨૪૬૪૪૭૬ (મો): +૬૧-७૦૪૬૦૬૪७૧૨	
₹.	૧. મે. વરમાલ સારોઝ, ૨. શ્રી જચેશભાઈ લાલજીભાઈ ગોચાણી (માલિક), ૩. શ્રી ભદ્રેશ લાલજીભાઈ ગોચાણી (જામીનદાર) ઢેક્સઢાઈલ માર્કેઢ શાખા, સુરત.	૦૨.૦૩.૨૦૨૦ રૂા.૯૬,૩૪,૨૨૨.૪૯ ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	(૧) શ્રી ભદ્રેશ લાલજીભાઈ ગોયાણીની માલિકીની સિમ્પલ ગિરવે મુકેલ ઈન્ડસ્ટ્રીયલ ખુલ્લો પ્લોટ ટાઈપની મિલકત જે પ્લોટ નં. ૧૨૨–૧૨૩, જય અંબે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગણેશ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે, દેલાડ–સાચણ રોડ, દેલાડ, સુરત ખાતે આવેલ હક્ક અને હિસ્સા સાથે. એરીયા ૨૮૪.૪૪ રકે. યાર્ડ (પ્રત્થક્ષ કળજો)	য়া. 3,60,000/- য়া. 3,60,000/-	A/C. No.: 311101980050000 IFSC Code: UBIN0531111	શ્રી રાહેશ સિલ્હા અધિકૃત અધિકારી, ટેક્સટાઇલ માર્જેટ શાખા, સુરત. ફોન : ૦૨૬૧-૨૪૬૪૪७૬ (મૉ): +૯૧-७૦૪૬૦૬૪७૧૨	
			(૨) શ્રી જચેશભાઈ લાલજીભાઈ ગોચાણીની માલિકીની મિલક્ત જે પ્લોટ નં. ૧૨૪, જય અંબે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગણેશ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે, સાયણ–અમરોલી રોડ, મોજે-દેલાડ, ગામ–ઓલપાડ, સુરત ખાતે આવેલ હક્ક અને હિસ્સા સાથે. (પ્રત્યક્ષ કળજો)	য়া. ৭૯,০০,০০০/- হ্বা. ৭,૯০,০০০/-			
			(૩) શ્રી જયેશભાઇ લાલજીભાઇ ગોયાણીની માલિકીની મિલક્ત જે પ્લોટ નં. ૧૨૫, બ્લોક નં. ૨૬૨, જય અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે, સાયણ—અમરોલી રોડ, મોજે–દેલાડ, ગામ– ઓલપાડ, સુરત ખાતે આવેલ હક્ક અને હિસ્સા સાથે. (પ્રત્યક્ષ કબજો)	য়া. ৭৫,০০,০০০/- য়া. ৭,৫০,০০০/-			
3.	મે. આર્થા ટ્રેકર્સના માલિક અલ્કેશ નવીનભાઇ લાડ, ભાવીન નવીનભાઇ લાડ વલસાડ શાખા, વલસાડ	3૧.૦૩.૨૦૧૯ રૂા.૧૮,૧૨,૨૩ <i>૧/-</i> ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	ભાવીન નવીનભાઈ લાડની માલિકી/ ગિરવે મુકેલની મિલક્ત જે રિથત દુકાન નં. ૪, ગ્રાઉન્ડ ફ્લોર, શુભ મંગલ એવન્થુ, નન્દાવાલા, એન.એચ. નં. ૮, વલસાડ ખાતે આવેલ તમામ હક્ક અને હિસ્સા સાથે. (પ્રત્યક્ષ કબજો)	য়া. ৭૫,৬८,০০০/- 	A/C. No.: 369901980050000 IFSC Code: UBIN0536997	શ્રી ઉમાશંકર આનંદ અધિકૃત અધિકારી, વલસાડ શાખા, વલસાડ (મૉ): +૯૧-७૮૦૦૦૨૧૯૨	
8.	રદ્યુનાથ હનુમાન પ્રસાદ ગુજજર વલસાડ શાખા, (ઇ-આન્દ્રા બેંક) વલસાડ	૦૧.૦७.૨૦૧૯ રૂા.૧૮,૪૬,૦૭૨/- ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	શ્રી રઘુનાથ હનુમાનપ્રસાદ ગુજજરની માલિકીની મિલકત જે ફલેટ નં. ૧૦૬, ક્ષેત્રફળ ૧૩૦૦ સ્કે. ફીટ. બિલ્ટ અપ એરીયા, પહેલો માળ, "મહાદેવ કોમ્પલેક્ષ" થી જાણીતી બિલ્ડીંગનું બાંધકામ વાળી બિન ખેતીલાયક જમીનનો બ્લોક/સર્વે નં. ૨૧૫ પૈકી, સિટી સર્વે નં. ૨૦૩૮, જે રિથત ડુંગરી, તાલુકા અને જિલ્લો-વલસાડ-૩૯૬૩૭૫ ખાતે આવેલ મિલકત. ચુતરસીમા: પુર્વે: ગલી • પશ્ચિમે: ખુલ્લી જગ્યા, • ઉત્તરે: ફ્લેટ નં. ૧૦૭, • દક્ષિણે: ખુલ્લી જગ્યા. (પ્રત્યક્ષ કબજો)	\$1. 2,00,000/-	A/C. No.: 216011100001112 IFSC Code: ANDB0002160	શ્રી મિક્ષીર રંજનદાસ અધિભૂત અધિભારી, વલસાડ શાખા, વલસાડ (ઇ-આન્ધ્રા ભેંજ) (મો): +લ૧-७७७503500૪	
ч.	શ્રી હિનેશ શાહ અને સહ–ક્ટજદાર શ્રી અભીમન્યુ દિનેશ શાહ અને શ્રીમતી મંજુદેવી દિનેશ શાહ ઇટલાવા શાખા, (ઇ-કોર્પો. બેંક) નવસારી	૧૧.૦૮.૨૦૧૯ રૂા.૧૩,૦૫,૮७ <i>૬/-</i> ચડત વ્યાજ અને અન્ય ખર્ચા સાથે.	ફલેટ નં. ૨૦૮, સુપર બિલ્ટ અપ એરીચા ક્ષેત્રફળ ૭૫૦.૦૦ સ્કે. ફીટ ચાને કે દૃદ.૭૦ સ્કે. મીટર અને બિલ્ટ અપ એરીચાનો ક્ષેત્રફળ ૫૩૫.૦૦ સ્કે. ફીટસ ચાને કે ૪૯.૭૨ સ્કે. મીટર, બિન ખેતીલાયક જમીન અવિભાજીત ભાગનો ક્ષેત્રફળ ૧૪.૫૦૨૫ સ્કે. મીટર, જે રિથત જમીનનો ક્ષેત્રફળ ૧૬૦.૨૦ સ્કે. મીટર, બીજો માળ, "રાધે રેસીડેન્સી"ના નામથી જણાતી બાંધકામ વાળી બિલ્ડીંગ, "એ" વિંગ, રેવન્યુ સર્વે નં. ૨૨૨, મ્યુનિસિપલ વોર્ડ નં. ૨, હાઉસ નં. ૫૨૭૪/૨૦૮, જે કાબિલપોર, બારડોલી રોડ, નવસારી, તાલુકા અને જિ. નવસારી ગુજરાત ખાતે આવેલ મિલક્ત. (પ્રત્યક્ષ કબજો)	হা. ৭,,৭3,০০০/- হা. ৭,,৮৭,3০০/-	A/C. No.: 1478013881200101 IFSC Code: CORP0001478	શ્રી મૃત્યુંજ્ય ઉત્તરવાલ અધિકૃત અધિકારી, (ઇ-કોર્પોરેશન બેંક) ઇટલાવા શાખા, નવસારી (મો): +દ૧-હપદહ૪૧૦૯૬૪	
ş. 9.	શ્રી નરેશ બાબુભાઈ કાકડીયા (કરજદાર), ર. શ્રીમતી રીટાબેન નરેશ કાકડીયા (જામીનદાર) સચીન શાખા, (ઈ-કોર્પો. બેંક) સુરત શ્રીમતી રીટાબેન નરેશ કાકડીયા (કરજદાર) શ્રી નરેશ બાબુભાઈ કાકડીયા (જામીનદાર) સચીન શાખા, (ઈ-કોર્પો. બેંક) સુરત	oe.os.૨૦૧૯ ફા. ૯,૨૪,૮૯૦/- ચડત વ્યાજ અને અન્ય ખર્ચા સાથે. oe.os.૨૦૧૯ ફા. ૮,૪૮,૬૫૮/- ચડત વ્યાજ અને અન્ય ખર્ચા સાથે.	દુકાન નં. યૂજી–3, ક્ષેત્રફળ રસ્પ સ્કે. ફીટ, જે સ્થિત ગ્રાઉન્ડ ફ્લોર, "પંચરત્ન ટાવર" સાથે અવિભાજીત સરખા ભાગની જમીનથી બંધાચેલ બિલ્ડીંગ, જે સ્થિત બાંધકામ વાળી જમીનનો આર.એસ. નં. રહ પૈકી, ટી.પી. સ્ક્રીમ નં. ૪, એફ.પી. નં. ૨૨૮ બી પૈકી, સિટી સર્વે નોંધ નં. ૧૭૦૫/૭/સી, ૧૭૦૫/૭/ડી, ૧૭૦૫/૬, ૧૭૦૫/૧૦ અને ૧૭૦૫/૧૧, ફુલ ક્ષેત્રફળ આશરે ૨૯૮૧.૫૫ સ્કે. મીટર, વોર્ડ નં. નવાગામ, સબ જિ. સુરત, જિ. સુરત ખાતે આવેલ સ્થાવર મિલકત. (પ્રત્થક્ષ કબજો)	\$1. 3,88,200/-	A/C. No.: 1369013881200101 IFSC Code: CORP0001369	શ્રી ગોવિંદપ્રસાદ દેહનીયા અધિકૃત અધિકારી, (ઇ-કોર્પોરેશન બેંક) સચીન શાખા, સુરત (મો): +૯૧-૯૫૭૫૭૩૧૪૬	
۷.	શ્રી ભૂપતભાઈ સેફાભાઈ નકુમ (કરજદાર) અને શ્રીમતી પ્રભાગન ભૂપતભાઈ નકુમ (સહ-કરજદાર), શ્રી બાળુભાઈ રામજીભાઈ કલસારીચા (જામીનદાર) સચીન શાખા, (ઈ-કોર્પો. બેંક) સુરત	૧૧.૦७.૨૦૧૯ ફ્રા. ૧૫,૯૩,૦७૮/– ચડત વ્યાજ અને અન્ય ખર્ચા સાથે.	પ્લોટ નં. ૧૪૨, ક્ષેત્રફળ દૃઢ.૭૩ સ્કે. મીટર, સ્પોટ મુજબ (કે.જી.પી. મુજબ બ્લોક નં. ૧૮૮/૧૪૨/બી, ક્ષેત્રફળ એરીચા દ્ર૩.દ્ર૨ સ્કે. મીટર) સાથે અવિભાજીત સરખા ભાગનો રોડ અને સીઓપીનો ક્ષેત્રફળ ૩૬.૩૩ સ્કે. મીટર, "શિવ સમર્થલાલ રેસીડેન્સી" થી જાણીતી સોસાચટી, સોસાચટીની જમીનનો નવું બ્લોક નં. ૧૮૮ (જુનો બ્લોક નં. ૧૮૮, ૧૮૯, ૨૩૧, ૨૩૨ અને ૨૩૩), જે સ્થિત ગામ-મણકાના, તાલુકા– કામરેજ, જિ. સુરત ખાતે આવેલ મિલકત. (પ્રત્યક્ષ કળજો)	੩।. ੧,੫੨,੨੦੦/- ੩।. ੧,੫੨,੨੦੦/-	A/C. No.: 1369013881200101 IFSC Code: CORP0001369	શ્રી ગોવિંદપ્રસાદ દેહનીયા અધિકૃત અધિકારી, (ઈ-કોર્પોરેશન બેંક) સચીન શાળા, સુરત (મો): +૯૧-૯૫૭૫૭૩૨૧૪૬	
е.	રવ. શ્રી જયસુખભાઈ બાલુભાઇ કુમ્મર, શ્રીમતી ઉદ્યાગેન જયસુખ દુમ્મર માસ્ટર, દર્પિત જયસુખભાઇ દુમ્મર, શ્રી બલુભાઇ દુમ્મર, શ્રીમતી નભુબેન બલુભાઇ દુમ્મર, શ્રી ચતુરભાઇ લાભુભાઇ રામાણી ન્યુ સિટી લાઇટ શાળા, સુરત	રદ.૦૨.૨૦૨૦ રૂા. ૧૬,७૪,७૩૯.७૩ ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	પ્લોટ નં. ૧૫૯, સનસ્ટાર સિટી, આત્મીથ સ્કૂલની સામે, કામરેજ, સુરત–૩૯૪૧૮૫ ખાતે આવેલ તમામ હક્ક અને હિસ્સા સાથે આવેલ મિલક્ત. (પ્રત્થ ક્ષ કબજે)	리. 95,05,000/- 	A/C. No.: 61060198005000 IFSC Code: UBIN061060	શ્રી કેશવ ઝા અધિકૃત અધિકારી, ન્યુ સિદી લાઇટ શાખા, સુરત (મો): +eq-cesseozoce	
90	શ્રી સુરજ પ્રસાદ વિજયકુમાર શુક્લા (કરજદાર) પાલોદ શાખા, સુરત	૦૨.૦७.૨૦૧૯ રૂા. ૮, ૭૯,૪ ૮૮.૩૪ ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	શ્રી સૂરજ પ્રસાદ વિજયકુમાર શુક્લાની માલિકીની મિલકત જે રિથત પ્લોટ નં. ૧૦૮, એરીયાનો ક્ષેત્રફળ ૪૦.૧૮ રકે. મીટર, શુક્ન રો–હાઉસ જેનો આર.એસ. નં. ૩૫૬/૧/એ, ૩૫૬/૧/બી, બ્લોક નં. ૧૪૮ (કે.જે.પી. મુજબ નવુ બ્લોક નં. ૧૪૮–૧૦૮), મોજે ગામ–મુળદ, તાલુકા–ઓલપાડ, જિ. સુરત ખાતે આવેલ તમામ હક્ક અને હિસ્સા સાથે. (પ્રત્થક્ષ કબજો)	રૂા. ૫,૮७,૦૦૦/- રૂા. ૫૮,७૦૦/-	A/C. No.: 685601980050000 IFSC Code: UBIN0568562	શ્રી રાજેશ ચોપરા અધિકૃત અધિકારી, પાલોદ શાખા, સુરત (મો): +૯૧-७૮૦७૫૦७७०	
99	શ્રીમતી નયનાએન પિતામ્બરભાઇ વોરા, (કરજદાર), જ્ઞાનેશ્વર જગન્નાથ દેવરા (જામીનદાર) પાલોદ શાખા, સુરત	૦૪.૦૯.૨૦૧૯ રૂા. ७,૩૪,૮૧૪/- ચડત વ્યાજ અને અન્થ ખર્ચા સાથે.	શ્રીમતી નયનાબેન પિતામ્બરભાઈ વોરાની માલિકીની પ્રાઈમરી સિક્યુરીટી વાળી જે પ્લોટ નં. ૦૨, ડીવાઈન રેસીડેન્સી, કૈલાશનગર, કોસમ્બા, તરસાડી, ઉતીચાદ્રા રોડ, મોજે–હથુરણ, તાલુકા–માંગરોળ, જિ. સુરત ખાતે આવેલ તમામ હક્ક અને હિસ્સા. (પ્રત્થક્ષ કબજો)	३।. <i>५,५०,००० -</i> ३।. <i>५५,००० -</i>	A/C. No.: 685601980050000 IFSC Code: UBIN0568562	શ્રી રાજેશ ચોપરા અધિકૃત અધિકારી, પાલોદ શાખા, સુરત (મો): +eq-७८०७૫०७७०	
45	મે. દુવ ક્રિએશનના પ્રોપ. સશવંતરાય ત્રિભોવનદાસ ભુસ્છાડા (કરજદાર) અને શ્રી પરાગભાઈ ચશવંતરાઈ ભુસ્છાડા (જામીનદાર) ન્યુ સિટી લાઈટ શાળા, સુરત	૦૨.૧૨.૨૦૧૯ રૂા. ૧૯,૧૧,૭૨૧.૧૬ ચડત વ્યાજ અને અન્ય ખર્ચા સાથે.	ફલેટ નં. ૧૦૧, બિલ્ડીંગ એ-3, મોડલ ટાઉન પાર્ક, લેન્ડ માર્કની પાછળ, પૂણા-કંભારીયા રોડ, મગોબ, સુરત આર.એસ. નં. ૨૩+૨૪/૭, બ્લોક નં. ૩૦, મોજે-મગોબ, ટી.પી.એસ. નં. ૬૪, (મગોબ-ડુંભાલ), એફ.પી. નં. ૪૬, સુરત સિટી, જિ. સુરત ખાતે તમામ હક્ક હિસ્સા સાથે. ક્ષેત્રફળ ૮૮.૯૪ સ્કે. મીટર, બિલ્ટ અપ એરીયા અને ૧૨૩.૫૧ રકે.મીટર સુપર બિલ્ટ અપ એરીયા (પ્રત્થક્ષ કબનો)	\$I. 5'80'000\- 	A/C. No.: 61060198005000 IFSC Code: UBIN061060	શ્રી કેશવ ઝા અધિકૃત અધિકારી, ન્યુ સિટી લાઇટ શાખા, સુરત (મો): +દ૧-૮૯૬૬૯૦૨૦૦૯	

બિલ્ટ અપ એરીયા (પ્રત્થક્ષ કબન્નો) • **ઇ-હરાજીની તારીખ અને સમય : ૦७.૧૦.૨૦૨૦ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાકે** (બોલી હરાજી બંધ પહેલા ૧૦ મિનિટની અંદર કરવામાં આવે છે. ઇ-હરાજી ૧૦ મિનિટના અમર્ચાદિત

એક્સટેશન સાથે, ૧૦ મિનિટ દરેક સમય વિસ્તૃત કરવામાં આવશે.

તારીખ : ૦૧.૦૯.૨૦૨૦

 બીડ જમા કરવાની છેલ્લી તારીખ : ૦૬.૧૦.૨૦૨૦ સાંજે ૫.૦૦ કલાકે ● બીડ ગુણાંકમાં : રૂા. ૧૦,૦૦૦/-

ઉપર જણાવેલ મિલકતોની નિરીક્ષણની તારીખ અને સમય : ૧७.૦૯.૨૦૨૦, બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી.

सुयना :-_ o વેચાણ શરતો અને નિયમો વિગત માટે કૃપા કરીને ં ભાગ લેતા પહેલાં સુરક્ષિત લેણદારો / સર્વિસ પ્રોવાઇડરની વેબસાઇટ : www.unionbankofindia.co.in / https://www.ibapi.ir

https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp જોઈ ઈ–હરાજીના ભાગ દ્વારા જોઈ જવી. અથવા શાખાનો સંપર્ક કરવો. રસ ધરાવનાર બીડરોએ રીઝર્વ કિંમતની ૧૦%ની ઇએમડીની રકમ પરત મળવા પાત્ર છે. તે NEFT/RTGS/fund Transfer અથવા ડીડી કે પે ઓર્ડર **યુનીયન ભેંક ઓફ ઇન્ડિયા, સુરત** માં જમા કરાવશો.

વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે મહેરબાની કરીને બેંકની વેબસાઈટ : www.unionbankofindia.co.in પર આપેલ લિંક જુઓ.

વેચાણના નિયમો અને શરતો સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ)રૂલ્સ ૨૦૦૨મા જણાવેલ જોગવાઈ અનુસાર રહેશે. હરાજીની વિગતો માટે અને મિલકર્તના નિરીક્ષણ માટે રસ ધરાવનાર બીડરો સંબંધિત શાખાઓના શાખા મેનેજર, રીઝનલ ઓફિસ : (મો)- ૯૦૯૯૨૩૫૮૫ અને ઝેનીથ રીકવરી એજન્સી - (મો) : ૯૮૨૪૨७७७૯ ઉપર જણાવેલ વિગતો મુજબ સંપર્ક કરી શકશે.

સરફેસી એક્ટ નિયમ ૮(૬) હેઠળ ૩૦ દિવસની કાયદેસરની વેચાણ નોટીસ સરફેસી રૂલ્સ ૨૦૦૨ની કલમ ૮(૬) મુજબ આ નોટીસ ઉધારકર્તા અને જમીનદારોને પણ આપવામાં આવે છે. જો તેઓ ઈ–હરાજી પહેલા બાકી લ્હેણાં ભરપાઈ કરશે નહી તો ઉપર જણાવેલ તારીખે મિલકતોનો વેચાણ કરી દેવામાં આવશે

(અસલ અંગ્રેજીથી અનવાદ)

અધિકૃત અધિકાર્ર यूनियन होंड ओફ ईन्डिय

ઉકાઇના ઉપરવાસમાં અંતે વરસાદે ઉપર સ્થિર થઇ છે. જયારે ડેમમાં હાલ ૮૧ વિરામ લેતા તમામ ડેમના દરવાજા બંધ હજાર ૩૪૮ કયુસેક પાણીની આવકની કરી દેવામાં આવ્યા હતા. જો કે હાલમાં પણ સામે ૧૭૮૭૯ કયુસેક પાણી છોડવામાં

ડેમમાં ૮૧ હજાર કયુસેક પાણીની આવક આવી રહ્યું છે. ડેમ સત્તાધીશોના જણાવ્યા

થઇ રહી હોવાથી ૧૭ હજાર કયુસેક પાણી મુજબ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફ્રુટ છોડવામાં આવી રહ્યુ સપાટી ૩૩૬.૬૩ કુટ હાઇડ્રો યુનિટ અને નહેરમાં ઉપરાંત આગામા હિવસોમાં વરસાદ પાણી છોડવાનું યથાવત ડેમના નોંધાય તેવી આગાહી

ઉપરવાસમાં

હોવાથી તકેદારીના વરસાદનું હળવો થઇ ગયો છે. છેલ્લા ભાગરૂપે ડેમનું લેવલ ૩૩૫-૩૩૬ ફુટની ૨૦ દિવસમાં અતિભારે વરસાદના કારણે આસપાસ રાખવામાં આવી રહ્યું છે. ડેમમાં દપપ૦ એમ.સી.એમ પાણીની આવક ત્રણ હાઇડ્રો યુનિટ અને કેનાલ મારફતે થઇ હતી, જેની સામે ૪૨૦૦ એમસીએમ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ પાણી છોડી મુકવામાં આવ્યું છે. જો કે હવે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું બંધ ઉકાઇના ઉપરવાસમાં વરસાદ ધીમો પડતો કરવામાં આવતા નદી કિનારાના લોકોને અને પાણીની આવકમાં ઘટાડો થતા ડેમનાં મોટી રાહત થઇ છે. સાથે જ માછીમારી તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. કરતા લોકોએ પણ અંતે રાહત અનુભવી છે.

જેઈઈ મેઈનની પરીક્ષાનો પ્રારંભઃ કોરોના મહામારીના કારણે પ્રથમ દ્વિસે રૂ ૩૨ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યાં

સમ્રગ દેશમાં જેઇઇ મેઇનની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સંપૂર્ણ રીતે ઓનલાઇન લેવામાં આવનારી પરીક્ષામાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન થઇ શકે તે માટે ૬ દિવસ ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે નોંધાયેલા પ૩૩ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૩૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

દેશની ઉચ્ચ ટેકનોલોજીકલ ઇન્સ્ટીયુટમાં પ્રવેશ માટે મહત્વની ગણવામાં આવતી જેઇઇ મેઇનનીં બીજા તબક્કાની

પ૩૩માંથી ૩૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ કોરોનાના ભયના કારણે બીજા તબક્કાની પરીક્ષા આપવાનું ટાળી રહ્યા હોવાનું શિક્ષણવિદોનું અનુમાન

પરીક્ષાનો અંતે પ્રારંભ થયો છે. તમામ પરીક્ષા સેન્ટર ખાતે વિદ્યાર્થીઓની યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જેઇઇ મેઇનની પરીક્ષામાં ૬ દિવસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સુરતના નોંધાયેલા કુલ ૮ હજાર ૧૦૬ વિદ્યાર્થીઓ અલગ-અલગ ૬ સેન્ટરો પરથી પરીક્ષા આપશે. પરીક્ષાના પ્રથમ દિવસે ઉન વિસ્તારના ખાનગી કલાસીસમાં આપવામાં આવેલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં નોંધાયેલા પ૩૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેઇઇ મેઇનની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવતી હોવાથી જાન્યુઆરી મહિનામાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ જે તે પરિશામથી સંતુષ્ટ હોય, અને હાલના કોરોના મહામારીના ભયના કારણે બીજા તબક્કાની પરીક્ષા આપવાનું ટાળી રહ્યા હોવાનુંઅનુમાનશિક્ષણવિદોલગાવીરહ્યાછે.

સુરત મહાનગરપાલિકા **જાહેરનામું**

નં.પી.આર.ઓ./૬૦૨/૨૦૨૦-૨૧

૮૨/બી



अधिरात आडियन

પ્રવિણ એસ.પારઘી-એડવોકેટ

મિલ્કત નંબર

ઘર નં.૬૩ થી દદ

ઘર નં.૬૯ થી હર

બિલ્ડીંગ-બી/૨, ફ્લેટ

નં.૨૦૧ થી ૨૦૪

ઘર નં.૨૦૧, ૨૦૨ અને

958

ઘર નં.૮७ થી ૧૧૦

બિલ્ડીંગ-સી , ફલેટ

નં .૮૦૫ થી ૮૦૮

બિલ્ડીંગ-એ

ઘર નં.૧૯૮ થી ૨૧૯

ઘર નં.૧૦૬ થી ૧૩૫

घर नं.१८ थी ३७

ઘર નં.७४ થી ૮૧

2195-0,

(इस इसेट-७८)

ઘર નં.૧૨૪ થી ૧૬૨

ઘર નં.૧૪૬ થી ૧૫૨

घर नं.१६८ थी १७४

ઘર નં.૮૩ થી ૯૯

ઘર નં.એ/૧૧૧ થી

ને/૧૨૩, ઘર નં.બી/૧૯

થી બી/3૬

બિલ્ડીંગ-એલ

(ਰਮਾਮ ਝਰੇਟ)

ઘર નં.૧૬૨ થી ૧७૫

15\$

મિલ્કતની અંદાજીત

58

45

55

30

36

90

50

৭४

3**6**0

ઈ.ચા.સીટી ઈજનેર

સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન સુરત મહાનગરપાલિકા

35

99

90

90

૧૪૫

03

900

Cω

85

૨૫૦

964

65

чω

902

904

ξ3

9443

આયોજીત **'શ્રધ્ધા સોસાયટી'** માં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નં. એ-૧૩૧ વાળી ૩૩.૪૫ ચો.મી.વાળી મિલકત

ના મારા અસીલ એકલા માલિક, કબજેદાર અને મુખત્યાર ચાલી આવેલા છે. જે મિલકત મારા અસીલ આમો ક્યાનંદ આ એ થી રમણભાઈ મોહનભાઈ નાયક પાસેથી મે.સુરત- 3 નવાગામ ના સવ રઝરદ્રાર સાહેબની કચેરીએ વેચાછ દસ્તાવેજ અનુ.નં. ૧૭૯૨૪ થી તા.૧૨-૧૨-૨૦૦૭ ના રોજ વેચાછા રાખેલ. તેની ઓરીજીનલ આર.આર. જેની પહોંચ નં. ૨૦૦૭૦૨૦૦૦૬૭૬૮ શરતચુકથી ગેરવલ્લે કે ગુમ થયેલ છે. મજકુર આર.આર. બાબતે કોઈ ઈસમ, સંસ્થા કે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને વાંધો, વચકો કે તર તકરાર હોય તો આ

જાદેર નોટીસ થયે દિન-હમાં અમેને ઉપરોક્ત સરનામે લેખિતમાં અથવા મોખિકમાં રૂબરુ આવી જાણ કરવી. મુદ્દત વિત્યે અમારા અસીલના આ બાબતે લેખિતમાં અથલા મોખિકમાં રુબરુ આવી જાણ કરવી. મુદ્દત વિત્યે અમારા અસીલના આ બાબતે ન-વાંધા પ્રમાણપત્ર આપવામાં આવશે. જેની જાદેર જનતાએ નોંધ લેવી.

મારી સુચનાથી : અમોદ દયાનંદ ઝા એ-૧૨૮, શ્રધ્ધા સોસાયટી, ડીંડોલી, સુરત.મોબા.નં. ૯૮૨૫૦ ૪૦૦૨૨

સુરત મહાનગરપાલિકા

જાહેરનામું

આથી હું જતીન એમ. દેસાઈ, ઈ.ચા. સીટી ઈજનેર, સુરત મહાનગર પાલિકા, સુરત

ગુજરાત રાજ્ય એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯७ની ક્લમ-૨, ૩ અને ૪થી પ્રાપ્ત સત્તા અન્વચે

ુ તથા ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના

જાહેરનામાં ક્રમાંક નં. NCV/102020/SF-1/G, Dt 20/03/2020ના પેરા નં.૧૧ તથા હુકમ નં DP/01/2020-214 NO.CNF/024 DT.02/04/2020 अन्वये भणेल अधिङारनी उसे सुरत

મહાનગર પાલિકામાં આવેલ સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત)ના નીચે જણાવેલ વિસ્તારોના

કલસ્ટરમાંથી મુક્ત કરેલ વિસ્તાર

સોસાયટી/વસાહતનું

ઉપાનગર, ભાઠેન

રાજ પેલેસ, ગોડાદર

ભંડારી ફળીયું

ડીંડોલી ગામ

સાંઈનાથ સોસાયટી

नवागाभ

સુમન શ્રુતિ , ગોડાદરા

કાય વ્યુ હાઈટ્સ, પરવ

રણછોડનગર, ભાઠેન

લિંબાયત

દ્યિરજનગર-૧, ગોડાદર

દ્યિરુજનગર-૧, ગોડાદર

વ્રજભુમી એપાર્ટમેન્ટ

4599

શ્રીનાથજી-૨, લિંબાયત

બજરંગનગર, પરવ

શિવદર્શન, ગોડાદરા

શામળાદ્યામ સોસાચટી

ગોડાદરા

શ્રી એવેન્યુ, ગોડાદરા

खरतीङ रेसीऽन्सी

नवागाभ

स्थण : सरत ता.३१-०८-२०२०

લોકોને કલ્સ્ટરમાંથી મુક્ત કરવાનો હુકમ કરું છું.

ફા. પ્લોટ

નંબર

G.S.

52

943,

88

9

ટી.પી.

સ્કીમ

નંબર

06

59

ડીંડોલી

४१

ξG

9.E

00

80

ξC

8C

80

ξ٩

ξ9

ના કેસો નોંધાચેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા, શહેરના કેટલાક વિસ્તારમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવુ જોઈએ તે જળવાતુ નથી. જેથી નોવેલ કોરોના વાયરસ ને સંક્રમણ ફેલાવવાની શકયતાઓ રહેલી છે. આથી ગુજરાત રાજય એપેડેમીક ડીસીઝ એકટ- ૧૮૯७ ની કલમ ૨,૩ અને ૪ થી પ્રાપ્ત સતા અન્વયે તથા ગુજરાત રાજયના આરોગ્ય અને

પરિવાર કર્લ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક NCV/102020SF-1/G DATE: 20/03/2020 ના પેરા નં. ૧૧ થી મળેલ અધિકારની રૂએ સુરત મહાનગરપાલિકામાં આવેલ વેસ્ટ ઝોન (૨ાંદ૨) ના નીચે જણાવેલ વિસ્તારોના લોકોને કલસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજીયાત હોમ કવોરન્ટાઈન રહેવા હુકમ કરવામાં આવે છે.

ક્રમ	િસ્તાર	અંદાજીત ઘરોની સંખ્યા	અંદાજીત વસ્તી
	માદ્યવ રેસીડેન્સી , ભુલકાભવન રકુલની પાછળ , આનંદ મહેલ રોડ "ડી" બિલ્ડીંગ	50	65
5	ખોડિયાર નગર ,અડાજણગામ (ઘર નં. સી-૫ થી સી-૧૦)	ξ	50
3	આગમ એપાર્ટમેન્ટ, વિજય ડેરીની સામે, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ રોડ	٩٤	ફર
8	દિવાળી બાગ સોસાયટી, ઋષભ ટાવરની સામેનો રસ્તો (ઘર નં. ૬૯ થી ૯૦)	55	65
ч	બેજનવાલા કોપ્લેક્ષ , રાદેર રોડ "જે" બિલ્ડીંગ	52	૧૦૫
ξ	રણછોડ પાર્ક સોસાયટી, રામનગર , ઝુલેલાલ મંદિરની પાછળ (ઘર નં. ૧૫૫ થી ૧૯૩)	9 <i>e</i>	ω3
6	વિશ્વકર્મા સોસાયટી, ભિક્ષુકગૃહની સામે, રામનગર (ઘર નં. ૬ થી ૨૨)	96	65
۷	શિવમ રો હાઉસ, રામેશ્વરની સામે, પાલ સી.એન.જી. પમ્પની પાસે (ઘર નં. એ-૧ થી એ-૧૮)	9८	٥٧
C-	એસ .એમ .સી . ક્વાટર્સ , સીટીઝન સ્કુલની બાજુમાં , એલ .પી .સવાણી સર્કલ પાસે , એ-૨ બિલ્ડીંગ	१६	ωe
90	સહસ્ત્રકૃણા રેસીડેન્સી , રાજકોર્નરની સામે , પાલ "બી" બિલ્ડીંગ	50	65
99	જ્ઞાનસાગર સોસાયટી, વોક વે રોડ, શિવમ રો હાઉસની સામે, એલ.પી.સવાણી સર્કલ પાસે (એ-૧ થી એ-૮) અને (એ-૧૨ થી એ-૧७)	৭४	પર
9.5	રાજવર્લ્ડ રેસીડેન્સી, નીલકંઠ રેસીડેન્સીની સામે, કેનાલ રોડ, પાલણપોર "બી" બિલ્ડીંગ	3ξ	૧૫૨
	કરતુરબા સોસાયટી, ટેકરાવાલા સ્કુલની બાજુમાં, (ઘર નં. ૧૧૩ થી ૧૩૫)	53	CC
৭४	કસ્તુરબા સોસાયટી, ટેક્રરાવાલા સ્કુલની બાજુમાં, (ઘર નં. ૧७૧ થી ૧७૯) અને (૧૮૩ થી ૧૯૨)	9 e	6-5
૧૫	સહજ ધામ રો હાઉસ, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ (ઘર નં. ७૮ થી ૮૮)	99	४८
٩ξ	મહાવી૨ ૨ો હાઉસ, હની પાર્ક ૨ોડ, (ઘ૨ નં. એ-૩૨ થી એ-૫૩)	55	6-5
96	શિવ કેમ્પસ, એલ.પી.સવાણી સ્કુલ પાસે , "બી' બિલ્ડીંગ	50	८४
9८	અચોધ્યાનગરી રો હાઉસ, અડાજણ હેલ્થ સેન્ટરની સામે, ભૂમિ કોમ્પલેક્ષ પાસે (ઘર નં. ૨૯ થી ૪૪)	१६	60
qe-	એવરગ્રીન સોસાયટી, પાલણપોર જકાતનાકા (ઘર નં. બી-હ થી બી-૧૬)	٩८	65
50	ગંગાનગર , નિર્વાણ શોપીંગ સેન્ટરની પાછળ , દાંડી રોડ જહાંગીરપુરા	95	૫૪
	રતુતિ હાઈલેન્ડ , ઉગત કેનાલ રોડ , પાલણપોર ફાયર સ્ટેશનની પાછળ , પાલણપોર "એ' બિલ્ડીંગ	٥८	522
55	" એો રંગા" વીર સાવરકર હાઈટસ, ઉગત કેનાલ રોડ, "સી' બિલ્ડીંગ	પર	૧૯૮
	કુલ	чоз	5035

ઉપરોક્ત હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, અન્થથા સદર હુકમનો અનાદર કરનારની સામે ઈન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮ તથ એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯७ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નં.પી.આર.ઓ./૬૦૬/૨૦૨૦-૨૧ ता.०१/०६/२०२०

ડે.કમિશનર (કરારીય) સુરત મહાનગરપાલિકા

इंडियन बैंक 🤼 Indian Bank 🛕 इलाहाबाद

નાનપુરા શાખા, સુરત : ૮૬૪, અથુંગર સ્ટ્રીટ, અલકનંદા-એપાર્ટમેન્ટ, નાનપુરા, સુરત-૩૯૫૦૦૧

કબજા નોટિસ (સ્થાવર મિલકત માટે) આથી, અમો નીચે સહી કરનારા, સીકચુરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ અને એન્ફોર્સમેન્ટ સીકચુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની જોગવાઇ હેઠળ ઇંડિયન બેંકના અધિકૃત અધિકારી છીએ અને મજકુર કાયદાના સેકશન ૧૩(૧૨) (નિયમ ૩ ને સાથે વાંચતા) અને સીકચુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ)નિયમ ૨૦૦૨ અતાર્ગત મળેલી સત્તાની રૂએ, તા.૧૨/૧૧/૨૦૧૯ના રોજ કરજદાર/જામીનદાર શ્રીમતી મિનાક્ષીબેન નેહલકુમાર કરારાર (કરજદાર અને મોર્ગેજર) ને ડિમાન્ટ નોટિસ પાઠવી હતી. સદર નોટીસ દર્શવિલી કરમ ૧૧૧૮ (૧૪૦૦૦ (૧૫)) સ્થાય મારા સ્થાય ક્લાય એક્સ્સ્સો સાલીસ અને તીસ પ્રાપ્ત પ્રસ્ત 31.૧૮,૮૫.૧૪૦.૨૦ (રૂપિયા અઢાર લાખ પંચ્ચાસી હજાર એક્સો ચાલીસ અને વીસ પૈસા પુરા) જે

રા.૧૮૮,૮૫,૧૪૦.૨૦ (રૂપિયા અઢાર લાખ પચ્ચાસી હજાર એકસા ચાલાસ અન વાસ પસા પુરા) જ ૧૧/૧૧/૨૦૧૯ ના રોજ બ્રાકી + ભવિષ્યુનું વ્યાજ તથા ખર્ચાઓ સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં પરત ચુકવવા જણાવ્યું હતું. કરજદારો/જમીનદારો નાણા ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયા હોઈ, કરજદારો/જમીનદારો/ મોર્ગેજરો તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે ઉપરોક્ત એક્ટના સેક્શન ૧૩(૪) રૂલ્સ ૮ સાથે વંચાણે લઈને, મળતાં અધિકારની રૂએ, બેંકના અધિકૃત અધિકારીએ નીચે દર્શાવેલ સ્થાવર મિલ્કતનો કબજો તારીખ ૦૧/૦૯/૨૦૨૦ ના રોજ સંભાળી લીધેલ છે. આથી ખાસ કરીને કરજદાર/જમીનદાર તથા જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે, કે તે

મિલ્કતો ઉપર કોઈપણ જાતનો વ્યવહાર કરવો કે કરાવવો નહિ કે લે-વેચ કરવી નહિ કે હસ્તાંત કરવો નહિ તથા જો એવું કરવામાં આવશે તો તે ઇંડિયન બેંક, નાનપુરા, સુરત ના બાકી પડતી રકમ રા.૧૮,૮૫,૧૪૦.૨૦ (રૂપિયા અઢાર લાખ પંચ્ચાસી હજાર એક્સો ચાલીસ અને વીસ પૈસા પુરા) જે તા.૧૧/૧૧/૨૦૧૯ ના રોજ બાકી અને ભવિષ્યનું વ્યાજ તથા ખર્ચાઓ સહિતની બાક

અહીં કરજદારનું હ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે, કે જણાવેલ સમય મર્ચાદામાં સેક્શન ૧૩ન સબ્ સેક્શન (૮) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકી લેણા ભરપાઈ કરી પાછી મેળવ

સ્થાવર મિલકતનું વર્ણન તમામ ભાગ અને હિસ્સો ધરાવતી સ્થાવર મિલકત જે પ્લોટ નં.૪૨ (કેજેપી પછી સર્વે ત ર૩૩/એ/૪૨),સ્થળ મુજબ જેનું માપ ૧૦૩.૦૦ ચોરસ ચાર્ડ એટલે કે ૮૬.૧૨ ચોરસ મીટર્સ રુ૩૩/અ/૪૨),સ્થળ મુજબ જનુ માપ ૧૦૩.૦૦ ચારસ ચાંડ અટલ ક ૮૬-૧૨ ચારસ માટસ. અને મંજુર પ્લાન મુજબ માપ બન્દ-૮૬ ચોરસ મીટર્સ , જેની સાથે રસ્તા અને સીઓપી માં વણ વહેંચાયેલ હિસ્સાનું માપ પ૦-૨૧ ચોરસ મીટર્સ તે શગુન વિલા સ્થિત જમીનનો રે.સ. નં. ૧૪૧,૧૫૪,૧૫૯,૧૬૧, હનીક નં. ૨૩૩/એ, માપ ૧૯૯૦૫.૦૦ ચોરસ મીટર્સ તે ગામ – ઇશાનપોર, તાઃ ઓલપાડ, છુ. સુરત–૩૯૪૧૫૦ જે મિનાક્ષીબેન નેહલકુમાર કંસારા (અગાઉ મિનાક્ષીબેન પટેલ તરીકે ઓળખાતા)ના નામની. આ મિલકતની ચતુઃ દિશા : ઉત્તરે – જોડાયેલ પ્લોટ નં.૪૧, પૂર્વે –જોડાયેલ બ્લોક નં.૨૩૨ ની જમીન, પશ્ચિમે – જોડાયેલ સોસાયટીનો રસ્તો.

અધિકૃત અધિકારી, ઇંડિયન બેંક, નાનપુરા શાખા, સુરત તારીખ : ૦૧/૦૯/૨૦૨૦

જાહેર નોટીસ

૪ત સરત ક્સ્ટિીકટ સબ-ક્સ્ટિીકટ સુરત સીટીના મોજે ગામઃ **કરાડવા**ના **રેવન્યુ સર્વે નંબરઃ ા,૧૩૦ તથા ૧૩૧, બ્લોક નંબરઃ ૧૩૧**, ક્ષેત્રફળ ૪૧૫૦૧ ચો.મી. જમીન પૈકીની સબ પ્લોટ ાંબરઃ ૧ વાળી ૨૧૮૪૩.૪૫ ચો.મી. બિનખેતીની જમીન પૈકી પર૧૭.૩૯ ચો.મી. પૈકી નાનગી પ્લોટ નંબરઃ બી જેનું ક્ષેત્રફળ ૩૨૨૧.૦૧ ચો.મી. વાળી બિનખેતીની જમીન પર આયોજીત **'સાકાર પેલેસ"** નામની સોસાયટી માં (મંજુર થયેલ પ્લાન મુજબ સબ પ્લોટ નંબરઃ ત્રી પૈકી એ ટાઇપ બીલ્ડીગ) જે સ્થળ મુજબ બીલ્ડીગ પૈકી **"એક"** બીલ્ડીગ માં **ત્રીજા માળે** આવેલ કલેટો પૈકી **કલેટ નંબરઃ એક/૩૦૩** વાળી મીલકત જેનુ સુપર બિલ્ટઅપ એરીયાનુ ક્ષેત્રફળ ૮૫૦ ચો.કુટ, જેનુ **બીલ્ટઅપ એરીયાનુ ક્ષેત્રફળ પર.૨૮ ચો.ચી.** છે. તે બાંઘકામ મળેની ૪મીનમાં ફાળે પડતા પ્રમાણસરના વણવહેચાણયેલ હિસ્સા સહિતની મિલકત એક **શ્રીયતી ત્રાવત્રીબેન કમલ સોની**ના નામે ચાલી આવેલી છે જે મિલકત તેમની પાસેથી અમારા અસીલ ોચાણથી રાખવા નક્કી કરેલ છે એવું જણાવીને તેઓ મારી પાસેથી સદરહું મિલકતના ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરી છે તેમજ એવું પણ જણાવેલ છે કે મજકુર મિલકતના ના ટાઇટલ ડીડસ∖પેપર્સ પૈકી **શ્રીમતિ સાવિત્રીબેન કમલ સોનીની તરફેશમાં થયેલ અને <u>મહેરબાન</u>** સૂરત-૬ (કુંભારીયા)ના સબ-રજીસ્ટ્રારશ્રી ની ક્ચેરીમાં એક નંબરની બુકમાં તારીખઃ ૦૧/૦૫/૨૦૧૮ રોજ અનુક્રમ નંબરઃ ૨૯૨૧ થી નોંધાયેલ વેચાણ દસ્તાવેજની સબ-રજીસ્ટ્રારશ્રી **હારા આપવામાં આવેલ અસલ રજીસ્ટ્રેશનની રસીદ** ગુમ થયેલ છે અને હાલ જડતા નથી. જેથે ગુમ થયેલ દસ્તાવેજો/પેપર્સે કોઇ પણ વ્યક્તિ ં∕ સંસ્થા / બેંક વિગેરે પાસે હોય અથવા સદરહું મિલકતમાં કોઇ પણ વ્યક્તિ / સંસ્થા / બેંક વિગેરનો કોઇ પણ જાતનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દર-દાવો હોય તો તેમણે દસ્તાવેજી પરાવાઓ સહિત **દિન-૭** માં નીચે જણાવેલા સરનામે લેખીતમાં જાણ કરવી. આમ મજકુર મુદત વીત્યેથી સદરહું મિલકતમાં કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, સંબંધ, દર-દાવો નથી અને અને જો હોય તો તે જતો ર્યો છે તેવું માનીને અમો મજકુર મિલકતનો ટાઇટલ ક્લીરન્સ સર્ટીફિકેટ આપીશું અને અમારા અસીલ મજુકુર મિલકતનો પાકો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ તેના માલિક પાસેથી કરાવી લેશે અને ત્યારબાદ તેઓ સદર મિલકત બેંક/નાણાંકીય સંસ્થામાં મોર્ગેજ કરવાની કાર્યવાહી કરશે જેથી નમારા મજકુર અસીલનો મજકુર મિલકત ઉપર સંપુર્ણ માલિકી અને કબજો રહેશે તેમજ સદર નેંક/નાણાંકીય સંસ્થાનો પ્રથમ બોજો/ચાર્જ રહેશે. ત્યારેબાદ મજુર મિલકત બાબતમાં કોઇની કોઇ ષ્ણ જાતની તર-તકરાર ચાલશે નહીં, તેની સર્વેએ નોંધ લેવી.

સુરેન્દ્ર ઔમપ્રકાશ સારસ્વત (એડવોકેટ)

ઓફીસ- :એફ-૭, ડી.જી. પોઇન્ટ, પર્વત પાટીયા, સુરત મો. નં. ૯૯૨૫૦-૧૩૯૩૩ (તા. ૦૨/૦૯/૨૦૨૦)

स्थल : सुरत સ્થળ : સુરત Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin, Palsana Road, Near Sachin, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Ring